



## જી.એમ.ડી.સી.ના નોંધાયેલા તેમજ નવા બ્રિક્સ ઉત્પાદક યુનીટ ધારકોને વર્ષ ૨૦૧૯-૨૦ની સિઝન દરમિયાન લિગ્રાઇટ મેળવવા બાબત

જી.એમ.ડી.સી.માં અગાઉ નોંધાયેલા તેમજ નવા બ્રિક્સ ઉત્પાદક યુનીટ ધારકોને લિગ્રાઇટના ક્વોટાની ફાળવણી શરુ કરાવવા માટે જી.એમ.ડી.સી.ની વેબસાઇટ લિંક <https://www.gmdcltd.com/download/All-Others/download5db14403a3849.pdf> (www.gmdcltd.com > Customer Care > Registration > Registration & Renewal Application Form for Bricks and Roofing Tiles) ઉપરથી નવું રજીસ્ટ્રેશન ફોર્મ ડાઉનલોડ કરી, તેમાં જણાવેલ ચેકલિસ્ટ મુજબના બધા જ દસ્તાવેજ, પ્રોસેસિંગ ફી તેમજ તમામ ભરેલી વિગતો સાથે ચેકલિસ્ટ પ્રમાણેના ક્રમમાં જી.એમ.ડી.સી.ની કચેરીના નીચે મુજબના સરનામે જમા કરાવવા.

સરનામું:

LIGNITE SALES DEPARTMENT  
7th Floor, GMDC LTD. 'Khanij Bhavan',  
132' Ft Ring Road, University Ground,  
Vastrapur, AHMEDABAD - 380 052

અગાઉથી નોંધાયેલ બ્રિક્સ ઉત્પાદક યુનીટ ધારકોએ પણ નવેસરથી બધા જ દસ્તાવેજ, પ્રોસેસિંગ ફી તેમજ તમામ ભરેલી વિગતો સાથે ચેકલિસ્ટ પ્રમાણેના ક્રમમાં રજીસ્ટ્રેશન ફોર્મ સાથે જમા કરાવ્યા બાદ, ચકાસણી કરી ફરીથી ચાલુ કરવામાં આવશે. ફાઇલ જમા કરાવ્યા બાદ ચકાસણી માટે ૧૫-૨૦ કામકાજના દિવસો સામાન્ય સંજોગોમાં થાય છે અને ત્યારબાદ મંજુર થયેલ ગ્રાહકોને તે પછીના પખવાડીયામાં ક્વોટા ફાળવણી કરવામાં આવે છે. જે અંગેની માહિતી ગ્રાહકના નોંધાયેલ email ID અને Mobile No. પર આપવામાં આવશે, તેમજ વેબસાઇટ પર પણ ક્વોટા ફાળવણીમાં જોઇ શકાશે.

1. માંગેલ દસ્તાવેજ ચેકલિસ્ટમાં ટિકમાર્ક કરવા તેમજ ચેકલિસ્ટ પ્રમાણેના ક્રમમાં જ જમા કરાવવા.
2. માત્ર જે તે ગ્રાહકના નામના જ email ID અને Mobile No. ફરજિયાતપણે જણાવવા.
3. રજીસ્ટ્રેશન ફોર્મમાં માગ્યા મુજબના GPS Coordinates લેવા Android મોબાઇલ ફોનમાં Google Maps એપ્લિકેશનનો ઉપયોગ કરી સાઇટ લોકેશન લેવું.
4. અગાઉ નોંધાયેલા કસ્ટમર આઇડીનો રજીસ્ટ્રેશન ફોર્મમાં ઉલ્લેખ કરવો. (જો હોય તો)
5. ઉપર મુજબની સુચના ઓ સંદર્ભે વધુ માહિતી કે માર્ગદર્શન માટે સંપર્ક નંબર : ૦૭૯-૨૭૯૧૩૨૦૦ એક્ષટેન્શન ૧૭૩૯.

અધુરી માહિતી ભરેલ ફોર્મ, અપુરતા દસ્તાવેજ અથવા સહી-સિક્કા વગરના દસ્તાવેજ, તેમજ ચેકલિસ્ટ પ્રમાણે ક્રમવાર દસ્તાવેજ નહી ગોઠવેલ ફાઇલોનો સીધેસીધો અસ્વીકાર કરવામાં આવશે, જેની નોંધ લેવી.

જી.એમ.ડી.સી.લિ. વતી,

ડે. જનરલ મેનેજર (લિગ્રાઇટ - માર્કેટીંગ અને સેલ્સ)